

બાળકો મટે પુષ્ટિ પૌષ્ટિક ટીક ખોથક આપવો બ મથક બ ક ગંભીર સવાલ છે. બાળક મટે પૌષ્ટિક ટીક ખોથકનો સુધયે કથવા મટે સથકારે તથા સ્થળોમં પહેલવૃત્તી તકિચ્વી જોઈ .

1. થષ્ટિક ટીક થીચ અને થષ્ટિક યના સઠ ટ્વની નીતી ના મધ્યચમ્થી અપુષ્ટિ આહાર છો કથવા અને જનમ સમ્યે છુ વજન દુર કથવા જવાબદારી લેવી જોઈ .

2. બ ક સુમ્દાય આધયતિદૃષ્ટિક ટીકોણનો ઉપયોગ બાળકના અપૂષ્ટ આહાર અને તેના વકસિસ મટે વાપથ્યો જોઈ .

3. વટિમનિ બ અને લોટામં ઉમ્થે કથવા તજવીજ કથવી, વટિમનિ અને ખનીજની ઉણપને લીધેથત નુકશાનને સંભેધમ કથવા.

અધ્યચત્તમ UNICEF ના આંકડા પ્તવે છે કે ૪૬ ટકા બધ બાળકો ૩ વથ ધની ઉમ્થ કથત નાના તેમની ઉમ્થ મટે બહુ નાના છે, ૪૭ ટકા બ છા વજનવાળા છે અને બ છામં બ છા ૧૬ ટકા બગડી ગયેલ છે. આમંથી ઘણા બાળકો ગંભીર પથથાણમં કુપોષતિછે. ત્મથ બાળકને પૌષ્ટિક ટીક આહાર આપવા મટે કેટલાક સુજાવો આપથ્યા છે. .

- ત્મથ બાળકને વવિધિપથથકાથના સઠ વસથથપૌષ્ટિક આહાર જેવા કે લીલા પાંદડાવાળી શાકભજી, તજા ફળો, વટાણા અને તેના જેવા આપો. .

- ત્મથ બાળકને પૂથથણપણે અનાજ ખાવા પથથેત્ત સાહીતકથે પણ તેને આખા અનાજના ઘણા ખાવાની ટેવને વકસિતિકથે. .

- દુધઅને બીજા દુધમા પદારથથે બાળકના વકસિસ મટે બહુ જથ્થી છે. તેસાથ કેલસચિમ્ના મુળ ત્થીકે કામ કથે છે, જે હાડકા અને ઘાત્તે સઠ વસથથથથથે છે, ઠે વથ ધની નીચેના બાળકો મટે પાત્તુ બ છી સ્થળીવાળુ દુધઆપવાની સલાહ નથી અપાતે પણ જુવાન બાળકોને અને કશિયેને પાત્તુ બ છા સ્થળીવાળા દુધમા પદારથથે નકકી થીતેઆપો. .

- જથથા સુધી મંસાહારી ખોથક લેવાનો સંબંધ છે, ત્મથ બાળકને પાત્તુ મંસ, મછલી અને મ્થ્યા ખાવા મટે પથથેત્ત સાહીતકથે. .

- ઘાથુ સેવન કથ્યુ તેચુવા બાળકો મટે બલિ કુલ સલાહકારી નથી. .

- અનન વા પસંદ કથે કે જેમં છુ મેઠુ અને છુ મ્થુ હોય. .

- વા ખાદધપદારથથેથી બ્થે કે જેમં ખાંડ અને સ્થળીનુ પથથાણ વધયે હોય. .

- જથથા સુધી થંધમાનો પથથશન આવે તે ત્મથે બફેલો, ઉકાળેલો અને ભઠ ઠીમં પકાવેલો આહાર ખનાવવાની પદધધપસંદ કથવી, નહી કે ત્મથાની પદધધધ.

- ત્મથા મટે તેમનો ઘણો ઉપયોગ કથ્યો પડશે, જેને લીધેત્મથે આહાર વધયે કેલેથીવાળો અને બ છો પૌષ્ટિક ટીક ખનશે.